

-:: વેચાણ દસ્તાવેજ ::-

જત ડિસ્ટ્રીક્ટ **મહેસાણા** સબ-ડિસ્ટ્રીક્ટ **કડી**ના તાલુકે **કડી**ના મોજે **કડી-કચ્છા**ની સીમના **ચી-સર્વે નં.૪૮૪/૦૦૨** (એકત્ર-સ.નં.૪૮૪/૦૦૨,૪૮૫,૪૮૬-જેનો જુ.સ.નં.૧૬૭૯/૧,૧૬૭૯/૨,૧૬૭૯/૩) ની રહેણાંક હેતુસાર જીનખેતી થયેલ છે.આરે.ચો.મી. ૧-૦૩-૮૪ ચાને ૧૦૩૮૪ ચો.મી. જેનો આકાર રા.૮.૬૨ પૈસાવાળી જીનખેતી ઉપયોગની ખુલ્લી જમીનમાં કડી નગરપાલીકાએ મંજૂર કરેલા નકશા મુજબ **“કે.એન. બંગ્લોઝ”** એ નામથી યોજના બાંધવામાં આવેલી છે તેમાં બાંધવામાં આવેલ મકાનો પૈકી **મકાન નંબર (.....)** જેમાં ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ચોરસ મીટર - **૬૬.૮૯ ચો.મી.** ના માપમાં તથા ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ ચોરસ મીટર - **૬૧.૦૩ ચો.મી.** ના માપમાં મળી કુલ ચોરસ મીટર - **૧૨૭.૯૨** ના માપનું બાંધકામ તથા બાંધકામને વરાડે પડતી જમીન **૬૭.૨૬** ચોરસ મીટર છે તથા સામુહીક વપરાશને વરાડે પડતી કોમન પ્લોટ તથા રોડ રસ્તા વપરાશની તેમજ સામુહીક પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે સહીતની મીલકતનો વેચાણ લેખ રા...../- અંકે રૂપિયા પુરાનો.

એક તરફવાળા : લખાવી લેનાર : વેચાણ લેનાર :-

..... ઉ.વ.આ. ...
ધર્મે - હિન્દુ, ધંધો -
રહેવાસી -
આધાર નંબર -

ખાન નંબર -

જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં “ તમો અને અગર “ એક તરફવાળા , લખાવી લેનાર , વેચાણ લેનાર ” એ રીતે સંબોધવામાં આવેલ છે જે શબ્દના અર્થના સંદર્ભમાં તમો વેચાણ લેનારનો તથા તમારા વંશ , વાલી , વારસો , એસાઈનીઓ , સક્સેસરો , એક્ઝીક્યુટરો , એડમીનીસ્ટ્રેટરો , ટ્રાન્સફરીઓ ઇત્યાદી તમામ લાગતા વળગતાઓનો સમાવેશ થાય છે .

બીજી તરફવાળા : લખી આપનાર : વેચાણ આપનાર :-

ઓમકાર ડેવલોપર્સના વ.કર્તા ભાગીદાર :-

PAN NO. - AAGFO 9218 C

પટેલ ઉત્સવ કનુભાઈ

ઉ.વ.આ.૩૨, ધર્મે-હિન્દુ, ધંધો-વેપાર,
રહેવાસી :- ૨૧, સુરભિ સોસાયટી, દેત્રોજ રોડ,
કડી, તા.કડી, જી.મહેસાણા.

જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં “ અમો અને અગર “ બીજી તરફવાળા , લખી આપનાર , વેચાણ આપનાર ” એ રીતે સંબોધવામાં આવેલ છે જે શબ્દના અર્થના સંદર્ભમાં “**ઓમકાર ડેવલોપર્સ**” એ નામથી ચાલતી ભાગીદારી પેટીનો તથા તેના હાલના તથા વખતો વખતના બદલાતા ભાગીદારો , વહીવટકર્તાઓ , એસાઈનીઓ , સક્સેસરો , એક્ઝીક્યુટરો , એડમીનીસ્ટ્રેટરો , ટ્રાન્સફરીઓ ઇત્યાદી તમામ લાગતા વળગતાઓનો સમાવેશ થાય છે .

અમો બીજી તરફવાળા , લખી આપનાર , વેચાણ આપનારની માલીકી કબજા ભોગવટાની જમીન જે જત ડિસ્ટ્રીક્ટ **મહેસાણા** સબ-ડિસ્ટ્રીક્ટ **કડી**ના તાલુકે **કડી**ના મોજે **કડી-કચ્છા**ની સીમના **રી-સર્વે નં.૪૮૪/૦૦૨** (એકત્ર-સ.નં.૪૮૪/૦૦૨, ૪૮૫, ૪૮૬-જેનો જુ.સ.નં.૧૬૭૯/૧, ૧૬૭૯/૨, ૧૬૭૯/૩) ની રહેણાંક હેતુસાર બીનખેતી થયેલ હે.આરે.ચો.મી. ૧-૦૩-૮૪ ચાને ૧૦૩૮૪ ચો.મી. જેનો આકાર રૂ.૮.૬૨ પૈસાવાળી બીનખેતી ઉપયોગની ખુલ્લી જમીન ક્ષેત્રફળ-૧૦૩૮૪.૦૦ ચો.મી. માટે અરજદારશ્રી પટેલ દશરથભાઈ બાબુલાલએ ગુજરાત જમીન મહેસુલ અધિનિયમ-૧૯૭૯ ની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગી મેળવવા તા.૯/૭/૨૦૨૦

ના રોજ ઓનલાઈન અરજીથી માંગણી કરતાં કલેક્ટરશ્રી મહેસાણાના તા.૪/૯/૨૦૨૦ ના હુકમ ક્રમાંક-૫૩૩/૦૪/૦૯/૧૨૦/૨૦૨૦ મુજબ રહેણાંક બિનખેતી ના રોજથી પરવાનગી આપેલ છે તે બીનખેતીવાળી જમીન અમો બીજી તરફવાળાએ તેના માલીકોશ્રી પટેલ દશરથભાઈ બાબુલાલ વિગેરેનાઓ પાસેથી તારીખ - ૧૯/૦૧/૨૦૨૧ ના રોજ વેચાણ રાખેલ છે તેનો વેચાણ લેખ કડી સબ રજીસ્ટ્રાર કચેરીમાં અનુક્રમ નંબર - ૬૫૩ થી નોંધાયેલ છે. જે જમીન અમો વેચાણ આપનારા વેચાણ દસ્તાવેજથી કાયદેસરના માલીકી મુખત્યાર બનેલા છીએ. સદરહુ જમીન રેવન્યુ રેકર્ડમાં અમો લખી આપનારના સ્વતંત્ર નામે ચાલે છે અને તેનો માલીકી હકકે કબજો ભોગવટો ધરાવીએ છીએ.

સદરહુ મોજે કડી, તા. કડી, જી. મહેસાણાના રી-સર્વે નં.૪૮૪/૦૦૨ (એકત્ર-સ.નં.૪૮૪/૦૦૨,૪૮૫,૪૮૬-જેનો જુ.સ.નં.૧૬૭૯/૧,૧૬૭૯/૨,૧૬૭૯/૩) ની રહેણાંક હેતુસાર બીનખેતી થયેલ છે. આરે.ચો.મી. ૧-૦૩-૮૪ ચાને ૧૦૩૮૪ ચો.મી. છે જેમાં કડી નગરપાલીકા દ્વારા ઓનલાઈન મંજુર કરેલા લે-આઉટ પ્લાન તથા નકશા મુજબ રજાચીઠી નંબર :- **1031LD20210013** તારીખ - ૨૭ / ૧ / ૨૦૨૧ ના રોજથી લે-આઉટ પ્લાન તથા બિલ્ડીંગ પ્લાન મંજુર કર્યા બાદ રજાચીઠી મેળવેલ છે. જેનો ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ **ODPS/2021/001331** થી મંજુરી મેળવેલ છે. જેમાં કુલ - ૫૩ રહેણાંકના મકાનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર - ૬૬.૮૯ ચો.મી. તથા ફર્સ્ટ ફ્લોર ઉપર - ૬૧.૦૩ કુલ મળી બાંધકામ ૧૨૭.૯૨ ચો.મી. તથા સુચીત કોમન પ્લોટમાં કલબ હાઉસની બાંધકામ કરવાની પરવાનગી આપેલી છે તે પરવાનગીમાં જણાવ્યા મુજબ સદરહુ જમીનમાં અમો વેચાણ આપનારે પોતાના ખર્ચે ડેવલોપમેન્ટનું કાર્ય કરેલ છે તે યોજનાનું નામ “કે.એન. બંગ્લોઝ” નામની યોજનાનું આયોજન કરેલ છે તે યોજનામાં બાંધવામાં આવેલ મકાનો પૈકી **મકાન નંબર - (.....)** બાંધકામ સહિતની રૂા...../- અંકે રૂપિયા પુરામાં વેચાણ આપેલી છે. જેનો વેચાણનો અવેજ તમો વેચાણ લેનાર પાસેથી ચેકથી મળી ગયેલ છે જે મળી ગયાનું સ્વીકારીએ છીએ અને તે અવેજ મળ્યાના બદલામાં જે મીલકત હાલ સ્થળ ઉપર જે સ્થિતિમાં છે તે સ્થિતિવાળી મીલકત કે જેનું

સંપૂર્ણ વર્ણન નીચે પરીશિષ્ટમાં આપવામાં આવેલ છે તે તમો વેચાણ લેનાર પાસેથી અમો વેચાણ આપનારે નીચે જણાવેલ વિગતેથી અવેજ લઈને સદરહુ બાંધકામ વાળી મીલકત અમો વેચાણ આપનારે તમો વેચાણ લેનારને કુલ અભરામ નંદાવે અઘાટ વેચાણથી હાલનો આ વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. તેમજ મજકુર વરાડે પડતી જમીનનો તથા સદરહુ મકાન વાળી મીલકતનો ખાલી અને પ્રત્યક્ષ કબજો અમો વેચાણ આપનારે આજરોજ તમો વેચાણ લેનારને સ્થળ ઉપર સોંપ્યો છે જે તમો વેચાણ લેનારે સંભાળી લીધો છે. જેથી મજકુર મીલકતના કબજા કે બાંધકામ બાબતે વેચાણ લેનારે સંપૂર્ણ ચકાસણી કરીને પ્રમોટરે બ્રોસરમાં બતાવેલ સ્પેશીફીકેશન, એમીનીટીઝ વિગેરે સુવિધાઓ સ્થળ ઉપર છે તે ચકાસી, ખાત્રી કરી આ મીલકત વેચાણ લેનારે ખરીદ કરેલ છે જે તેઓને સંતોષકારક છે અને વેચાણ લેનાર બાંધકામ કે એમેનીટીઝ અંગે કોઈ તકરાર લઈશુ નહીં અને વેચાણ લેનાર કે તેઓના વારસદારો ભવિષ્યમાં કોઈ કોર્ટ કાર્યવાહી કે તકરાર કરીશુ નહીં કે વેચાણ લેનારે રેરા કે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવી કરાવવાની નથી જેની આથી વેચાણ લેનારે સદર દસ્તાવેજમાં સહી કરી તેની કબુલાત કરી અમો વેચાણ આપનારને ખાત્રી અને બાંહેધરી આપેલ છે.

-:: પરિશિષ્ટ ::-

જત ડિસ્ટ્રીક્ટ મહેસાણા સબ-ડિસ્ટ્રીક્ટ કડીના તાલુકે કડીના મોજે **કડી-કચ્છાની** સીમના **રી-સર્વે નં.૪૮૪/૦૦૨** (એકત્ર-સ.નં.૪૮૪/૦૦૨,૪૮૫,૪૮૬-જેનો જુ.સ.નં.૧૬૭૯/૧,૧૬૭૯/૨,૧૬૭૯/૩) ની રહેણાંક હેતુસાર બીનખેતી થયેલ હે.આરે.ચો.મી. ૧-૦૩-૮૪ ચાને ૧૦૩૮૪ ચો.મી. જેનો આકાર રૂ.૮.૬૨ પૈસાવાળી બીનખેતી ઉપયોગની ખુલ્લી જમીનમાં કડી નગરપાલીકાએ મંજુર કરેલા નકશા મુજબ **“કે.એન. બંગ્લોઝ”** એ નામથી ચોજના બાંધવામાં આવેલી છે તેમાં બાંધવામાં આવેલ મકાનો પૈકી **મકાન નંબર - (.....)** જેમાં **ગ્રાઉન્ડ ફ્લોરનું બાંધકામ ચોરસ મીટર - ૬૬.૮૯ ચો.મી.** ના માપમાં તથા **ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ ચોરસ મીટર - ૬૧.૦૩ ચો.મી.** ના માપમાં મળી **કુલ ચોરસ મીટર - ૧૨૭.૯૨** ના માપનું બાંધકામ તથા બાંધકામને વરાડે

પડતી જમીન ૬૭.૨૬ ચોરસ મીટર છે તથા સામુહીક વપરાશને વરાડે પડતી કોમન પ્લોટ તથા રોડ રસ્તા વપરાશની તેમજ સામુહીક પાર્કિંગની ૬૭.૨૬ ચો.મી. વ્યવસ્થા કરવામાં આવેલ છે તે સહીતની મીલકત આ વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલી છે જેના ખૂંટની વિગત નીચે મુજબ છે.

પૂર્વ :-

પશ્ચિમે :-

ઉત્તરે :-

દક્ષિણે :-

એ પ્રમાણેના ખૂંટ વર્ણનવાળી બાંધકામ સાથે તમોને વેચાણ આપેલ છે.

સદરહુ મકાન અંગે તમો વેચાણ લેનારે વીમો, ઈન્સ્યોરન્સ ફરજિયાત ઉતરાવવાનો રહેશે અને તે અંગેનું પ્રિમિયમ તમો વેચાણ લેનારે ભોગવવાનું રહેશે.

સદરહુ તમોને જે મીલકત વેચાણ આપી છે તેટલી મીલકતના માપ સિવાય બાકીની મીલકતમાં તમારો કોઈ હક્ક - દાવો રહેશે નહીં એટલે કે વેચાણ આપેલ મીલકતની ચાર દિશા વચ્ચેની માલીકી તમો વેચાણ લેનારની રહેશે.

સદરહુ મકાનના કુલ વેચાણ કિંમત ઉપરનો જી.એસ.ટી.,વહીવટ ખર્ચ, જી. ઈ. બી. કનેક્શનને લગતો તમામ ખર્ચ, ગેસ લાઈન, કર કે ઉપકર સરકારી રેકર્ડમાં નામ ટ્રાન્સફર ખર્ચ, હાલમાં કે ભવિષ્યમાં સરકાર તરફથી કોઈ વધારાની સ્ટેમ્પ ડ્યુટીની ડીફરન્સની રકમ, પેનલ્ટી તથા ભવિષ્યમાં લાગુ પાડવામા આવનાર પશ્ચાદવર્તિ અસર સહિતના તમામ પ્રકારના વેરાઓ વિગેરેની રકમો તથા વ્યાજ, દંડકીય વ્યાજ સહીતની તમામ રકમો વિગેરે તમો વેચાણ લેનારે ભોગવવાનો રહેશે.

-:: વેચાણ અવેજની રકમ પહોંચ્યાની વિગત ::-

રૂા./-

અંકે રૂપિયાપુરાના ચેક નંબર

-તા..... ના રોજનો

.....શાખાના ચેકથી વેચાણ
લેનારે વેચાણ આપનારને ચૂકવી આપેલ છે.

કુલ..૩૧...../- અંકે રૂપિયા પુરા.

આમ ઉપર મુજબ વેચાણ અવેજની રકમ ૩૧...../-
- અંકે રૂપિયા પુરા તમો વેચાણ લેનારે અમો
વેચાણ આપનારને ચૂકવે ચૂકવી આપ્યા છે જેથી મીલકતની ચુકવે હિસાબની
રકમ મળ્યા બદલ અમો વેચાણ આપનાર આ વેચાણ દસ્તાવેજથી તમો
વેચાણ લેનારને કબુલાત આપીએ છીએ અને હવે પછી સદર મીલકત પેટે
તમો વેચાણ લેનાર પાસેથી વધારાના અવેજની કોઈ રકમ અમો વેચાણ
આપનારે લેવાની નથી.

મજકુર વેચાણ આપેલ મકાન એટલે પ્લોટ તથા તે ઉપર કરવામાં આવેલ
બાંધકામની અમો વેચાણ આપનારે ઉપર મુજબની ઉચ્ચક રકમ ગણેલ છે જેમાં
મકાનની ખુલ્લી જમીન અને બાંધકામની અલગ કિંમત દર્શાવેલ નથી.

મજકુર મીલકત આ લેખના આધારે પરભારે સરકાર રેકર્ડમાં
તમો વેચાણ લેનારના ખાતે કરાવી લેવાને માટે તમો તમારા વંશ, વાલી,
વારસો, માલીક મુખત્યાર છો તેમજ અમો વેચાણ આપનારા પણ જરૂર
પડતા તમામ રેકર્ડમાં તમો વેચાણ લેનારના ખાતે કરી આપવા બંધાયેલા
છીએ તેમજ તેમાં જરૂર પડતી સહીઓ, સંમતીઓ, કબુલાતો કરી આપીશુ
તે સહી.

મજકુર મીલકતનો ઉપયોગ યા વ્યવસ્થા વેચાણ હકકે માલીક
તરીકે તમો વેચાણ લેનાર તમારી મરજી પ્રમાણે કરવાને માટે તમો તમારા
વંશ, વાલી, વારસો માલીક મુખત્યાર છો તે સહી. તેમજ અમો વેચાણ
આપનારે કે અમારા વંશ, વાલી, વારસોનો કોઈનો કોઈપણ જાતનો
હકક હિસ્સો કે દાવો રાખેલો નથી તે સહી. પરંતુ મજકુર મીલકત વેચાણ
લેનાર જ્યારે વેચાણ કરવા માંગો કે ભાડે આપવા માંગો ત્યારે સોસાયટીની
કમીટીના સભ્યોના નીમેલા પ્રમુખ / મંત્રીની સંમતી લેવાની ફરજિયાત

લેનાર મજકુર મીલકત ભાડે કે વેચાણથી આપી શકશો નહીં તેવી શરતે મજકુર મીલકતનો આ વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે.

સદરહુ મીલકત અમો વેચાણ આપનારાઓની સંયુક્ત માલીકી અને કબજા ભોગવટાની છે અને તેમાં અમારા સિવાય બીજા કોઈનો કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક-હીત સંબંધ નથી તથા તે કોઈની જમ્તીમાં નથી કે ઈન્કમટેક્સ, સેલટેક્સ કે એક્સાઈઝે ટાંચમાં લીધેલ નથી કે છે નહીં, તથા કોઈની જમીનગીરીમાં લખી આપી નથી તથા આ મીલકત ઉપર કોઈનો કોઈપણ જાતનો ભરણપોષણનો બોજો નથી તથા તે કોઈને ગીરો, વેચાણ બક્ષીસ આપી નથી તથા કોઈએ વળતરમાં લીધી નથી તથા કોઈને બાનાખતથી કે બીજી કોઈપણ રીતે લખી આપી નથી તેવો વિશ્વાસ અને ભરોસો આપીને તમોને આ મીલકત વેચાણ આપેલ છે.

મજકુર મીલકત અમોએ તમો વેચાણ લેનાર સિવાય બીજા કોઈને કોઈપણ પ્રકારે ગીરો, બક્ષીસ કે વેચાણથી લખી આપેલ નથી કે બોજામાં મુકેલ નથી તેવો પુરો વિશ્વાસ આપી અમોએ તમોને વેચાણ આપેલ છે છતાં ભવિષ્યમાં કોઈની કોઈપણ પ્રકારની હરકત અટકાયત આવશે તો અમો વેચાણ આપનાર અમારા પોતાના ખર્ચે અને જોખમે દુર કરી આપીશું તે સહી.

સદરહુ રહેણાંકની જમીનમાં કોમન પ્લોટ તથા કોમન રસ્તાઓ લે-આઉટ પ્લાનમાં જણાવ્યા પ્રમાણે આવેલા છે તે કોમન પ્લોટ અને કોમન રસ્તાઓની સંયુક્ત માલીકી સદરહુ સ્કીમની જમીનમાં આવેલ તમામ મકાનો વેચાણ લેનાર મકાન હોલ્ડરોની સહીયારી રહેશે અને સદર કોમન પ્લોટ તથા કોમન રસ્તાઓનો ઉપયોગ વેચાણ લેનાર મકાન હોલ્ડરોએ કોમન પ્લોટનો ઉપયોગ કોમન પ્લોટ તરીકે અને કોમન રસ્તાઓનો ઉપયોગ કોમન રસ્તા તરીકે કરવાનો રહેશે તેમાં કોઈપણ પ્લોટ હોલ્ડરે અડચણ અવરોધ ઊભા કરવાના નથી કે બાંધકામ કરવાનું નથી તેમજ કોમન પ્લોટ તથા કોમન રસ્તાઓના ભરવા પડતા તમામ પ્રકારના ટેક્સ, વેરાઓ પ્લોટ હોલ્ડરોએ વરાડે પડતા ભરવાના રહેશે અને તે શરતોને આદીન અને શરતને અનુસરવાની શરતે સદર જમીનમાં આવેલ રહેણાંક મકાનો વેચાણ રાખનાર મકાન હોલ્ડરને વેચાણ આપવામાં

મજકુર મીલકત અંગે આજદીન સુધી રાષ્ટ્રીયકૃત બેન્કો, સહકારી બેન્કો, શરાફી પેઢીઓ કે ફાયનાન્સ કંપની કે હાઉસિંગ ફાયનાન્સ કે સરકારી અર્થ સરકારી કોઈ લેણી રકમ બાકી લેવાની નીકળતી નથી અને તે અંગેની કોઈ જવાબદારી બાકી નથી. મજકુર મીલકત અમારી સંપૂર્ણ માલિકીની તથા અમારી કુલ સંપૂર્ણ સ્વતંત્ર પ્રત્યક્ષ કબજા ભોગવટાની આવેલી છે. મજકુર મીલકત વેચાણ આપવાનો, તથા તેના વેચાણ અવેજના પુરેપુરા નાણા મેળવવાનો અમો વેચાણ આપનારને સંપૂર્ણ સ્વતંત્ર અબાધિત અને અનિયંત્રિત હક્ક અને અધિકાર છે.

મજકુર મીલકતના અમો વેચાણ આપનારના તમામ હરકોઈ રાઈટ્સ, ટાઈટલ્સ સંપૂર્ણપણે ચોખ્ખે ચોખ્ખા, માર્કેટેબલ અને તમામ પ્રકારના બોજાઓથી મુક્ત છે અને મજકુર મીલકતના વેચાણ અવેજના નાણાં લઈને અમોએ તમોને મજકુર મીલકતનો આ વેચાણ દસ્તાવેજ કરી આપીએ છીએ.

મજકુર મીલકતનો અમો તમોને વેચાણ દસ્તાવેજ કરી આપીએ ત્યાં સુધી સરકારી કરવેરા, મહેસુલ વિગેરે લેણાં બાકી નથી તેમ છતાં બાકી નીકળી આવે તો તે તમામ અમારે ચુકવી આપવાના રહેશે અને મજકુર મીલકત તમોને ચોખ્ખે ચોખ્ખી અને ના કરજી કરી આપવાની છે મજકુર મીલકતના આજ પછીના સમય માટેના જે કોઈ સરકારી કરવેરા, મહેસુલ, ફાળા વિગેરે આવે તે તમામ ચુકવવાની જવાબદારી તમો વેચાણ લેનારની રહેશે.

સદરહુ સ્કીમમાં આવેલ મકાનો પૈકી મકાન નંબર - વાળી મીલકત જ તમો વેચાણ લેનારને વેચાણથી આપેલ હોઈ તે વેચાણ રાખેલ મીલકત સિવાય અન્ય કોઈપણ મીલકત ઉપર તમો વેચાણ લેનારનો કોઈપણ જાતનો લાગભાગ હક્ક હિસ્સો હિત સબંધ રહેશે નહીં અને સદરહુ સ્કીમમાં આવેલ અન્ય મકાનો અમો વેચાણ આપનાર અમારી મરજી મુજબ વેચાણ કરવા અને અમો વેચાણ આપનારને યોગ્ય લાગે તે કિંમતો પ્રમાણે બુકિંગ / વેચાણ કરવા હક્કદાર છીએ અને રહીશુ તેમાં તમો લખાવી લેનારની કોઈપણ જાતની તકરાર લેવાની નથી કે ભવિષ્યમાં પણ તેવી કોઈ તકરાર કે વાંધો વિરોધ કરવાનો નથી.

સદર મીલકતનું કામ પૂર્ણ થયેથી સમયસર મીલકતનો કબજો અમો બીજી તરફવાળાએ સોંપવાનો છે.તેમજ કોમન એરીયાનું તથા ઓક્યુપેશન સર્ટી લાવી આપવાનું રહેશે.

સદર મીલકતનો બાનાખતનો કરાર તારીખ-.....ના રોજ રજીસ્ટર કરાવેલ છે.જેનો રજીસ્ટ્રેશન નંબર -.....છે.

સદર મીલકતનું કામ પૂર્ણ થયેથી સમયસર મીલકતનો કબજો અમો વેચાણ આપનારે સોંપવાનો છે.

સદર “કે.એન. બંગ્લોઝ” નામની યોજનામાં કોમન મેઈન્ટેનન્સ અંગે જે કોઈ નોન રીફન્ડેબલ આગોતરા મેઈન્ટેનન્સ ચાર્જીસ કે ફાળો નક્કી કરવામાં આવે તે તમોએ સર્વિસ સોસાયટીમાં ફરજિયાત પાછો અલગથી જમા કરાવવાનો છે તેમજ સદરહુ યોજનાની હાલની તેમજ ભવિષ્યની તમામ સહિયારી સુવિધાઓ જેવી કે કોમન સ્ટ્રીટ લાઈટ, કોમન રોડ-રસ્તાઓ, કોમન પાણીની લાઈન, ગેસની લાઈન, ઈલેક્ટ્રીક લાઈન, બાગ બગીચા, બાળકોને રમત ગમતના સાધનો, સોસાયટીનું કોમન બિલ્ડીંગ, મેઈન ગેટ, રંગ-રોગાન, સફાઈ ખર્ચ, સીક્યોરીટી અંગે તથા આનુસાંગીક તમામ ખર્ચની રકમ આગોતરા મેઈન્ટેનન્સ ચાર્જીસની રકમ તથા તેમના વ્યાજની રકમમાંથી ખર્ચવામાં આવશે અને તે ઉપરાંતનું ખર્ચ કરવાની ભવિષ્યમાં જરૂરીયાત ઉભી થાય તેવા સંજોગોમાં સર્વિસ સોસાયટી તરફથી વહીવટી ખર્ચની જે રકમ નક્કી કરવામાં આવે તે રકમો તમોએ અલગથી જમા કરાવવાની રહેશે. ઉપરોક્ત રકમો તમો વેચાણ લેનાર ભરવામાં કસુર કરો તથા તમારૂં કોઈપણ પ્રકારનું લેણું બાકી હોય તેવા સમયે સદર સર્વિસ સોસાયટી તમારી અનિવાર્ય અને આવશ્યક સહિતની તમામ સુવિધાઓ પાણી, ગટર, વિજળી તથા અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા હકકદાર રહેશે. અને સદર સર્વિસ સોસાયટીમાં તમામ ફ્લેટ માલીકોએ ફરજિયાત સભ્ય થવાનું રહેશે.

રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ - ૨૦૧૬ ની જોગવાઈઓ મુજબ સદરહું મીલકતમાં કોઈપણ પ્રકારની માળખાકીય ખામી લખાવી લેનાર દ્વારા અમો લખી આપનારને લેખીત માં જાણ ઉપર

લાવવામાં આવશે તો અમો લખી આપનારને તે માળખાકીય ખામી કોઈપણ પ્રકારનો વધારાનો અવેજ લીધા સિવાય દુર કરી આપવની જવાબદારી અમો લખી આપનારની રહેશે. જે આ વેચાણ દસ્તાવેજ કરીને આપે તે સમયે બધી જવાબદારી બીજી તરફવાળાની પુર્ણ થાય છે. વેચાણ દસ્તાવેજ કર્તા પહેલા લખી લેનાર એક તરફવાળાએ આ તમામ ખામીઓ પુર્ણ કરીને વેચાણ દસ્તાવેજ કરાવેલ છે. મજકુર મિલકત નો વેચાણ દસ્તાવેજ થઈ ગયા પછી બીજી તરફવાળા વેચાણ આપનારની કોઈ માળખાકીય જવાબદારી રહેશે નહીં તે શરતે. સદર મિલકતની અંદર વેચાણ લેનારે પ્રમોટર/બીજી તરફવાળાએ જે બાંધકામ આપેલ છે એમાં કોઈપણ જાતની તોડફોડ (સમારકામ) કે નવું બાંધકામ કરશે તો તેની કોઈપણ ખામીઓ ની જવાબદારી અમો વેચાણ આપનારની રહેશે નહીં તે શરતે. વધુમાં સદરહુ મીલકતમાં આવેલ ફ્લોરીંગ પર આવેલ ટાઈલ્સ ધોવા માટે જલદ એસીડનો ઉપયોગ, રફ ઉપયોગ તથા દિવાલોમાં તોડફોડ વિગેરેથી મજકુર મીલકતને નુકશાન થવાનો સંભવ છે. તેથી લખાવી લેનારે ફ્લોરીંગ પર આવેલ ટાઈલ્સ ધોવા માટે જલદ એસીડ, ગરમ તથા સખ્ત પાણી, રફ ઉપયોગ કરવો નહીં, તેમ છતાં જો કરશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં તેવી તમામ સ્પષ્ટ શરતો સાથે સદર મીલકતનો વેચાણ દસ્તાવેજ અમો વેચાણ આપનારે તમો વેચાણ લેનારને કરી આપેલ છે. તેમજ મજકુર મીલકતના બાંધકામમાં ઈંટો, લોખંડ, લાકડું તથા પથ્થર વાપરેલ છે તો લાકડુ ચોમાસામાં ભેજના કારણે ફુલે છે જે કુદરતી બાબત છે અને તેવા સમયે બારી બારણાં વાખવા ખોલવામાં તકલીફ પડે છે તેમજ ઈંટ માટીમાંથી બનેલ હોઈ તેમાં રહેલ કુદરતી ક્ષારના કારણે દિવાલમાં ભેજ ઉભરે કે દિવાલને નુકશાન થાય તો તે બાબતે અમો વેચાણ આપનાર સામે કોઈપણ જાતની ફરિયાદ કરી શકશો નહીં.

સદરહુ સ્કીમમાં આવેલ અન્ય મકાનોના માલીકોને કે અન્ય મીલકતોને નુકશાન થાય તેવું કોઈપણ કૃત્ય તમો વેચાણ લેનારે કરવાનું નથી અને સદરહુ વેચાણ આપેલ મકાનમાં કાયદાથી પ્રતિબંધીત ચીજ વસ્તુઓ, જલદીથી સળગી ઉઠે તેવા સ્ફોટક પદાર્થો, જલદ પદાર્થો, ગંધ માટે અગર સ્વાસ્થ્યને નુકશાનકારક પદાર્થો રાખવાના નથી તેમજ સદરહુ મકાનમા તમોએ કોઈ અસામાજીક પ્રવૃત્તિ કે કાયદા વિરુદ્ધનું કોઈપણ

કૃત્ય કરવાનું નથી જો તેમ કરવામાં કોઈ કસુર કરશો તો તેનાથી ઉત્પન્ન થતી ખર્ચ સહિતની તમામ પ્રકારની જવાબદારી તમો વેચાણ લેનારની રહેશે.

મજકુર જમીન ઉપર જે “કે.એન. બંગ્લોઝ” નામની યોજનામાં સ્કીમ તૈયાર કરેલી છે તેમાં રહેણાંકના હેતુથી કુલ - મકાનો નંગ-૫૩ આવેલ છે જેમાં તમામ મકાનના સહિયારા રોડ-રસ્તા અને પાર્કિંગ, કોમન પ્લોટ, ગાર્ડન તથા કલબ હાઉસ આવેલ છે. જેનો વાપરવાનો ઉપયોગ મકાન માલિકોએ સંયુક્ત હળી મળીને સહીયારો કરવાનો રહેશે.તેનો મેઈન્ટેનન્સ ખર્ચ તમામ મકાન માલિકોએ સંયુક્ત રીતે વરાડે પડતો કરવાનો છે અને રહેશે તેના ઉપર કોઈપણ જાતનું બાંધકામ કરવા કરાવવાનું નથી અને આ સ્કીમના અન્ય મીલકતના માલિકોને નુકશાન થાય તેવું કૃત્ય કરવાનું નથી તેમજ રસ્તાની જમીન ખુલ્લી રાખવી અને તે વેચાણ લેનારે તેમજ અન્ય સહમાલિકોએ રસ્તા તરીકે હંમેશા વાપરવાની છે.

સદર મકાન માલિકોને જે જીવન જરૂરી મુજબ ફેબ્રીકેશન એટલેકે લોખંડનું બહારની બાજુમાં ફેબ્રીકેશન શેડ બનાવવાનો થતો હોય તો તે સોસાયટીના પ્રમુખ/મંત્રી તથા કમીટી માં જે નિર્ણય થાય તે પ્રમાણે એક સરખા બનાવવાના રહેશે. તથા બે મકાન વચ્ચેની કોમન (મઝીયારી) દિવાલ જે ડેવલપર્સ/પ્રમોટરે જે ઉંચાઈ કરેલી છે તેનાથી વધારે ઊંચી કરવાની રહેશે નહીં અને મકાન વચ્ચેની દિવાલ એ બાજુમાં રહેતાં મકાન માલિક તથા તમો એક તરફવાળા વેચાણ લેનારની સહીયારી/ મઝીયારી મીલકત છે.જે દિવાલ પર બાથરૂમ/સંડાસ/સ્ટોર રૂમ (કોઈપણ પ્રકારનો) બાંધકામ કરવાનું નથી તે શરતે સદર મીલકત બીજી તરફવાળાએ એક તરફવાળાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે.

“કે.એન. બંગ્લોઝ” માં આવેલ ડ્રેનેજ લાઈન તથા વિગેરે સુવિધાઓ સહીયારી રહેશે તથા આ મીલકતમાં ઉપર નીચે જે પાણીની ટાંકીઓ બનાવવામાં આવે તે પણ ઉપર નીચેવાળા બધાની સહીયારી રહેશે અને તેનો તમામ પ્રકારનો મેઈન્ટેનન્સનો ખર્ચ બધાએ વરાડે પડતો પોત-પોતાના હિસ્સે આવતો ભોગવવાનો છે.

આ મીલકતમાં જવા-આવવાના રસ્તાના તથા પાણીના નિકાલના સર્વે પ્રકારના હક્કો સાથે જેવા કે ડ્રેનેજ, પાણીની લાઈનો, ઇલેક્ટ્રીક કનેક્શન લેવા તથા કોમન વાયરનો ઉપયોગ વિગેરે સર્વે પ્રકારના લેવાના હક્કો સાથે સદરહુ મીલકત ઉપર લખેલા રૂપિયા તમારી પાસેથી લઈને તમોને ચાવત ચંદ્ર દિવાકરો કુલ અભરામ નંદાવે અઘાટ વેચાણ આપી છે. તેમ છતાં કોઈ હક્ક - દાવો કરતો આવશે તો તે દુર કરી આપવાની જવાબદારી અમો વેચાણ આપનાર છે સદરહુ મીલકતના તમો વેચાણ લેનાર તથા તમારા વંશ, વાલી, વારસો સર્વે સ્વતંત્ર માલીક મુખત્યાર થયા છો અને તેનો માલીકી હક્ક વાપર ઉપયોગ, ઉપભોગ કરવા સદરહુ મીલકતનું સંપૂર્ણ બાંધકામ થયેથી તે મીલકત ગીરો, વેચાણ, બક્ષીસ કરવા તથા તમોને ફાવે તે રીતે તેનો વાપર વહીવટ કરવા અને વ્યવસ્થા કરવા તમો તથા તમારા વંશ, વાલી, વારસો, સર્વે હક્કદાર અને અધિકારી થયા છો જેથી સદર મીલકત ઉપર અમો વેચાણ આપનાર તથા અમારા વંશ, વાલી, વારસોનો કોઈનો કોઈપણ જાતનો હક્ક - હીત સબંધ કે લાગ ભાગ કે દર - દાવો રાખેલો નથી કે રહેશે નહીં.

સદરહુ સ્કીમમાં મુકવામાં આવેલ સહિયારી સુવિધાઓ જેવી કે કોમન પ્લોટ, કોમન રોડ - રસ્તા વિગેરેનો તમો વેચાણ લેનારે તથા અન્ય માલીકોએ સહીયારો ઉપયોગ ઉપભોગ કરવાનો રહેશે અને કોઈને અડચણ થાય કે નડતર રૂપ થાય તેવું કોઈ વધારાનું બાંધકામ કે દબાણ કરવાનું નથી. તેમજ સદરહુ યોજનામાં આવેલ તમામ મકાનો માલીકોએ સહિયારી સુવિધાઓનો ઉપયોગ સહીયારો કરવાનો છે અને તેના મેઈન્ટેનન્સમાં કે અન્ય કાર્યોમાં કોઈએ કોઈપણ જાતનો વાંધો, અડચણ કે અંતરાય કરવાનો નથી.

સદરહુ **“કે.એન. બંગ્લોઝ”** સ્કીમના બાંધકામ અંગે કોઈપણ પ્રકારની કુદરતી આફતો જેવી કે પુર, ઘરતીકંપ, વાવાઝોડુ, આગ કે અન્ય કોઈ માનવ સર્જીત આફતો યુદ્ધ, હુલ્લડ, આંતર વિગ્રહને કારણે જાન માલની હાનિ સર્જાય, મકાનોને નુકશાન થાય તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે તે મકાન માલીકની રહેશે તે બાબતે અમો વેચાણ આપનારની

સદરહુ રહેણાંકની યોજનાનું નામ “કે.એન. બંગ્લોઝ” રાખેલ છે અને હંમેશા તે જ રહેશે અને કોઈપણ મકાન માલીક તે બદલી શકશે નહીં.

સદરહુ મીલકત અંગે ભવિષ્યમાં કોઈપણ જાતનો વિવાદ ઉભો થાય તો તેવા કોઈપણ વિવાદનો નિકાલ સમાધાનથી લાવવાનો રહેશે. જો સમાધાનથી ઉકેલ ન આવે તેમ હોય તો રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ - ૨૦૧૬ ના નિયમો અને શરતોની જોગવાઈઓને આધીન રેરા સત્તા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.

-:: કરારનું રદીકરણ ::-

જો આ કરારમાંથી કોઈપણ જોગવાઈ, કહેવાયેલ અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલ હોય તેવા કોઈ નિયમો અને નિયમોથી અથવા લાગુ પડતા અન્ય કોઈ કાયદાઓથી રદ અથવા બીન અમલપાત્ર બનતી હોય તો, તેવી જોગવાઈ આ કરારના હેતુ સાથે અસંગત હોય તેટલા અંશે અને આ અધિનિયમ અથવા તે હેઠળ ઘડવામાં આવેલા નિયમો અને નિયમનો અથવા લાગુ પડતા અન્ય કોઈ કાયદા સાથે અસંગત હોય તેટલા અંશે તે સુધારેલી અથવા રદ થયેલ હોવાનું ગણાશે અને આ કરારની શેષ જોગવાઈઓ, આ કરારના અમલમાં આવ્યા સમયે જે રીતે લાગુ પડતી હતી તેવી જ રીતે માન્ય અને અમલપાત્ર હોવાનું ગણાશે.

પ્રમોટર આથી એવી સ્પષ્ટતા તેમજ જાહેર કરે છે કે બી. યુ. સી. (વસવાટનું પ્રમાણપત્ર) મળેથી ભવિષ્યની મળવાપાત્ર કોઈપણ એફ એસ આઈ અને ટેરેસ રાઈટમાં અમો પ્રમોટરના કોઈ હક્ક હિસ્સો રહેતો નથી. અને આવી જે કોઈ ભવિષ્યમાં એફ. એસ. આઈ. મળે તો તેના હક્કદાર તમો એસોસીએશન ઓફ એલોટીની એટલે કે સોસાયટીની રહેશે.

સદર કરારની રૂએ ઉદભવેલ પક્ષકારઅધિકાર અને ફરજોનું અર્થઘટન અને અમલ ભારત સરકારના જે તે વખતના લાગુ કાયદા કાનૂન અનુસાર કરવાનું રહેશે અને ન્યાય ક્ષેત્ર મહેસાણાની નામદાર કોર્ટનું રહેશે.

આ વેચાણ દસ્તાવેજ અમો વેચાણ આપનારે અમારી રાજીખુશીથી વાંચી , સમજી , વિચારી , વાકેફ થઈ કોઈના કોઈપણ જાતના દાબ - દબાણને વશ થયા વિના અક્કલ હોંશિયારીથી લખી આપેલ છે જે અમોને તથા અમારા વંશ , વાલી , વારસોને કબુલ મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે .

મત્તા : બીજી તરફવાળા : લખી આપનાર : વેચાણ આપનાર :-

ઓમકાર ડેવલોપર્સના વ.કર્તા ભાગીદાર

(પટેલ ઉત્સવ કનુભાઈ)

સાક્ષીની સહીઓ :-

(૧) -----

(૨) -----

રજીસ્ટ્રેશન એક્ટ - ૧૯૦૮ ની કલમ - ૩૨ - એ મુજબનું પરિશિષ્ટ

એક તરફવાળા
વેચાણ લેનાર

ફોટો

અંગુઠાની છાપ

.....

બીજી તરફવાળા
વેચાણ આપનાર

ઓમકાર ડેવલોપર્સના વ.કર્તા ભાગીદાર

(પટેલ ઉત્સવ કનુભાઈ)

મોજે. કડી, તા.કડી, પોસ્ટલ એડ્રેસ :- મકાન નં. “કે.એન. બંગ્લોઝ”

વેચાણ આપનારની સહી

વેચાણ લેનારની સહી